

RAJ RAYON INDUSTRIES LIMITED

(A Government Recognised Star Export House)

Corporate Off.: 5C/196 & 197, AKSHAY MITTAL INDUSTRIAL ESTATE, SAKINAKA, ANDHERI (E), MUMBAI-400 059 (INDIA) 🖺 : +91 - 22 - 4034 3434 ● Fax : +91 - 22 - 4034 3400 ● E-mail : mumbai@rajrayon.com ● Website : www.rajrayon.com CIN NO.: L17120DN1993PLC000368

Date: 15/11/2021

To,

The Secretary	NATIONAL STOCK EXCHANGE OF INDIA LIMITED				
BOMBAY STOCK EXCHANGE LIMITED	Listing Department				
P J Towers	Exchange Plaza, 5 th Floor,				
Dalal Street, Fort,	Bandra-kurla Complex,				
Mumbai 400 001	Bandra (East), Mumbai – 400 051.				
Company Code No. : 530699	Company Code : RAJRAYON				

Dear Sir,

Sub: Compliance under Regulation 30 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 (the "Listing Regulations") - Newspaper Publication

Dear Sir/ Madam,

Pursuant to Listing Regulation 30 and other applicable provisions of Listing Regulations, please find enclosed copies of extract of the Financial Results of the Company for the quarter ended September 30, 2021 published in the following newspapers on November 13, 2021:

i. Free Press Gujarat (English); and

ii. Lokmitra (Gujarati)

Kindly take the above information on your record and acknowledge.

Thanking you, Yours faithfully,

For RAJ RAYON INDUSTRIES LIMITED

Sandfip S. Agarwwal **Chief Financial Officer**

Encl: As above



Letters to the: Younger generation should be taught about acts of genocide



Sir — A survey commissioned by the Conference on Jewish Material Claims Against Germany found that more than half of the respondents across the United Kingdom did not know that six millions Jews lost their lives in the Holocaust and 32 per cent were unable to name a concentration camp or ghetto, including Auschwitz. Hearteningly, the study also found that an overwhelming majority are of the opinion that the Holocaust must be taught in schools.

ghetto, including Auschwitz. Hearteningly, the study also found that an overwhelming majority are of the opinion that the Holocaust must be taught in schools.

This reminds me of a conversation with a British university graduate who was, to my surprise, completely unaware of the Jallianwala Bagh massacre. There is clearly a gap in the British school system in this regard. Unless the younger generation is taught about acts of genocide, such barbaric events could happen once again. Sir — With the situation worsening in Afghanistan, it was essential that states in the region came together to discuss their concerns regarding cross-border terrorism as well as the humanitarian crisis in the country. The Delhi Regional Security Dialogue on Afghanistan, which took place yesterday, was attended by representatives from Iran, Kazakhstan, the Kyrgyz Republic, Russia, Tajikistan, Turkmenistan and Uzbekistan. It was unfortunate that China and Pakistan declined to attend the security dialogue. The internal turbulence in Afghanistan is bound to affect other countries in the region. All neighbouring states should have come together to ensure that the Taliban keeps its promise of inclusive and moderate governance. Sir — A little over two months after the United States of America withdrew its troops from Afghanistan, the executive director of the World Food Programme, David Beasley, has said that the country is facing a massive food crisis. A majority of Afghans—95 per cent — do not have access to adequate food and 23 million people are on the brink of starvation. The regional security dialogue on Afghanistan in New Delhi was crucial to determine the approach of its neighbours in handling the crisis. Pakistan and China share close ties with the Taliban government and their attendance would have been pivotal. At the moment countries must put aside their differences and prioritize the well-being of the ordinary people of Afghanistan site. The publical instability that severely affected people's access to basic resources, including decates for the Anisal offorthers to be sentineed for their crimes. It is of utmost importance that the judiciary in India is overhauled to improve the pace of the judicial process. Sir—The sentencing of the Ansal brothers was long overdue. Hopefully it will ease some of the pain of the families of the victims.

Statement of Standalone and Consolidated Ur

otal Comprehensive Income for the pe comprising Profit / (Loss) for the pe fter tax) and Other Comprehen Earnings Per Share (of Rs. 10/- Each) (fo

Place: Ahmedabae Date: 12/11/2021

Quarter Ended 0/09/202

Quarter Ended 0/06/202

Shrill outrage

A scourge called Woke politics

A scourge called Woke politics

When he arrived in England in the early 1970s to begin a life of self-imposed exile from an India that never really understood or appreciated his quirky endition, Nirad C. Chaudhur is said to have remarked that it was like returning from the battlefront. Niradbabu was an incorrigible contrarian who often said things calculated to shock and, in the process, give himself a laught However, the idea of the erstwhile mother country being a refuge from crasness — if you knew how to avoid its seamier underside — has always held out an appeal to those who felt somewhat detached from the jostle of life. Yet, the Anglophilia of the Unknown Indian was never blind. Even while living in an agreeable part of gentle Oxford, Niradbau couldn't but lament — in the words of the famous hymn — the "change and decay, all around 1 see.." Writing in The Daily Telegraph in 1988, he observed: "in England today, the public aspects of decline are tacitly admitted... There is a startling acceptance of brutishness and incivility. But there does not seem to be even a suspicion that decay may also have penetrated the English mind, although no external decadence can come about without inner decadence having set in."

Some 33 years after that article was published, the outward signs of decline are less evident. The London 1 first encountered in 1975 needed a strong dose of urban renewal. Today's London is energized, smart and very, very prosperous. The Brexit scare notwithstanding, the United Kingdom has returned to being an agreeable place attracting everyone, from Russian oligarchs to illegal immigrants from North Africa, and retaining its role as a global financial center. It even boasts a prime minister who, for all his other imperfections, has a way with words and an impish sense of humour. Moreover, as I discovered during visits last month to Rudyard Kipling's home in Bateman's and Winston Churchill's country retreat in Chartwell, both lovingly cared for by the National Trust, the "green and Winston Churchi



from, say, the secession of Scotland from the Union. However, some trends are unmistakable and linked to what Chaudhuri presciently saw as the "decay" that may have "penetrated the English mind". There is little doubt that the British identity is undergoing a fundamental reinvention. Some of it is the inevitable outcome of the most profound post-1950 demographic transformation the island has witnessed in its entire history. That today's Britain boasts a home secretary, a chancellor of the exchequer, an industry secretary and an elected mayor of London who are non-white speaks volumes of the new UK. This visible cosmopolitanism is, quite predictably but uneverly, leaving its mark on the power structure and, more important, the social and intellectual climate of the land. Thanks to its history as a trading nation and the experience of Empire, Britain has always had an acceptance of things foreign and a simultaneous suspicion of foreigners. The best of British universities combined a rich tradition of pageantry with an intellectual openness that, despite the relative paucity of resources compared to counterparts in the United States of America, have serviced the new knowledge economy well. My experiences in London and Oxford suggested a om, say, the secession of Scotland from the Union

non-offensive, soft Britishness that, combined with scholastic rigour and a culture of irreverence, kept nearly everyone (apart from a clutch of uber radicals) reasonably happy. It is this delicate equilibrium, evolved through the traditional British muddle, that is in danger of being overturned. I got a small sample of this emerging Woke culture at the ongoing Hogarth and Europe exhibition at the Tate Britain. What was needless were the captions to the paintings of one of the world's best social caricaturists. A ridiculous one was that which accompanied a self-portrait of Hogarth on a mahogany chair (picture). "Could the chair," the curators asked, "also stand in for all those unnamed black and brown people enabling the society that supports his vigorous creativity?" To add to this overinterpretation, an entire section carried an alert to hyper-sensitive souls that there were paintings with racist overtones.

At least a great collection of Hogarth was on view. This week, the National Gallery released a report prepared by University College, London, that warned undiscerning visitors that a section of its collection, including paintings by Thomas Gainsborough and donated by William Wordsworth, was somehow linked to the slave trade. According to The Daily Telegraph report, Gainsborough painted two pictures of families whose wealth derived from the slave trade. Wordsworth, who presented a John Constable painting in 1837, has been included in the offenders' list "because his sister's rented cottage was leased by a slave-owner." It is fortuitous that India's Parsi philanthropists didn't leave bequests to the gallery and further muddy the waters. There is Woke outery over a locomotive model from India that is displayed in the National Railway Museum in York and many students and alumni have demanded that the Seeley Historical Library (named after famous Regius Professor of History whose books were widely read) in Cambridge be renamed because its resent name "reflects the university's historic and ongoing justificatio

After Covid Iull, Ahmedabad societies put redevelopment on fast track



AHMEDABAD: Cracked Ills, fragile roofs, and king pipes – residents of old s had to continue living with these problems when they were forced to put their redevelopment plans on the backburner due to Covid-19. However, things are finally looking up for them as Ahmedabad witnesses a flurry of proposals and consent for redevelopment of old and dilapidated residential

buildings. Around 105 societies, mainly low-rises in posh western areas, have either agreed or are in the midst of signing MoUs with developers to raze and rebuild their houses. Of these, 55 societies gave their consent in 2021. In September 2018, the state government amended the Gujarat Ownership Flats Act (1972) to allow redevelopment of 75%, instead of 100%, members. This gave a boost to redevelopment projects. However, the situation turned gloomy when Covid struck. However, the situation turned gloomy when Covid struck. People feared going for redevelopment as they did not want to move to rented houses or feared delay in project execution due to the pandemic. Since the beginning of 2020, however, around 105 societies have chosen to go for redevelopment. On an average, 3-4 societies have

Place: Mumbai Date: November 11, 2021

applied for redevelopment every month since January this year," said an AMC official. In all, some 1,100 low-rise

In all, some 1,100 low-rise societies which are 25 years or older are eligible for redevelopment, reveals data from the Ahmedabad Municipal Corporation's town planning department. These 2- or 3-storeyed buildings are mainly concentrated in areas like Navrangura. Paldi like Navrangpura, Paldi,

Stadium, Vadaj, Vasna, Maninagar, parts of Chandkheda, parts of Naroda, and newly incorporated old AUDA areas in the western

AUIDA areas in the western part of the city.

"Developers are targeting low-rise societies in western areas so that they can exploit the underutilized Floor Space Index (FSI) of 3.6 and 2.7 to transform the space into a 14-transver austransver 4 defe the storeved apartment," adds the works best for developers.

AMC official.
Jitendra Shah, founder of
the recently formed 80member urban redevelopment housing redevelopment nousing society welfare association (URHSWA), claims that his association members are in talks with 67 housing societies and 15 projects are currently underway. "The undertuilized FSI of old low-rise societies works bet for developers."

Software engineer duped online

RAJKOT: The lure of finding a partner on an online platform landed a software engineer and three others in trouble. The four fell for an online cheating scam operated by a gang from Alwar in Rajasthan. Rahul Parmar, a software engineer, told police that he got in touch with a woman through an online dating application. Parmar initiated



conversation through WhatsApp, but it later turned out that the woman's profile was a fake one and it was being operated by four men.

er 30.2021

RAJ RAYON INDUSTRIES LIMITED

CIN No. L17120DN1993PLC000368

Registered office: Survey No. 1771/13, Village - Suranji, Dist - Silvassa,
Dadra & Nagar Haveli (UT) - 396 230. Tel: 91-22-40343434, Fax: 91-22-40343400,

EXTRACTS OF UNAUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER AND HALF YEAR ENDED ENDED 30-SEPTEMBER-2021

(Rs. in Lakhs, unless otherwise sti							
No.	Particulars	Quarte	Year ended				
		30-Sept-21	30-Sept-20	31-Mar-21			
		(Unaudited)	(Unaudited)	(Audited)			
1	Total Income from Operations (Net)	-	1.02	95.61			
2	Net profit / (loss) for the period (before Tax,						
	Exceptional and/or Extraordinary items)	(870.71)	(891.53)	(3,477.82)			
3	Net profit / (loss) for the period before Tax (after						
	Exceptional and/or Extraordinary items)	(870.71)	(891.53)	(3,477.82)			
4	Net profit / (loss) for the period after Tax (after						
	Exceptional and/or Extraordinary items)	(870.71)	(891.53)	(3,477.82)			
5	Total Comprehensive Income for the period						
	(Comprising Profit/(Loss) for the period (after						
	tax) and other comprehensive income (after tax))	(870.71)	(891.53)	(3,477.82)			
6	Equity Share Capital	3,464.54	3,464.54	3,464.54			
7	Other Equity			(64,023.65)			
8	Earning Per Share (Face Value of Re. 1/- each)		1				
	Basic (in Rs.) (Not annualised)	(0.25)	(0.26)	(1.00)			
	Diluted (in Bs.) (Not annualised)	(0.25)	(0.26)	(1.00)			

Quarter Ended 10/09/2021

Regulation 33 of Secti (Leasing Congress) we shall be a second or section 135 of the Companies Act, 2013 and other recognises and policies to the Congress of Board of Discretors.

It is a summary of the Congress of Section 135 of the Congress of Section 135 of the Companies Act, 2013 and other recognises and policies to the Congress of Section 135 of of S

YASH CHEMEX LIMITED FORMERLY KNOWN AS YASH CHEMEX PRIVATE LIMITED 411, 4 TH FLOOR, SIGMA ICON-1, OPP. MEDILINK HOSPITAL SATELITE, AHMEDABAD-380015. "TELE:- 079-40028639/26730257/26730258, Email:- yashchem@hotmail.com, "Website:- www.yashchemex.com" CIN:L74110GJ2006PLC048385

ed Financial Results for the Ou

Sd/ Pritesh Shah Managing Director DIN: 00239665

- :
 The above is an extract of the financial results have been prepared by the management of the Company basis information and explanation provided by Resolution Professional (RP). These results have been reviewed and recommended by the Audit Committee and approved by boar of directors along with the RP in their meetings held on 11th November, 2021. These results have been prepared in accordance with indian Accounting Standards as prescribe under Section 13d of the Companies (Act 2013 read with Raide of the Companies (findian Accounting Standards) Amendment Rule 2016.
- under Section 133 of the Companies (Indian Accounting Companies) Standards) Rules, 2015 and the Companies (Indian Accounting Companies) Regulation and Disclosur Requirements) Regulations, 2015 has been completed by the auditors of the Company and the have expressed a modified conclusion.

 In full format of the Quarterly Results are available on the webstes of the stock exchanges is the special of the Company and the stock exchanges is the special of the Company of the Stock exchanges is the special of the Company of the Stock exchanges is the special of the Stock exchanges in the special of the Stock exchanges is the special of the Stock exchanges in the S

On behalf of Board of Directors Mr. Sandiip Agarwwa Chief Financial Office

After initial messages on WhatsApp, Parmar made a video call to the woman. During the video call the woman's face was covered. woman's face was covered. Meanwhile, the person on the other side of the call took a screenshot of the video call. Later, Parmar's face, recorded during the video call, was morphed and used in a pornographic video. The video was then sent to Parmar and he was asked to pay Rs 5,000 through a payment sent to Parmar and he was asked to pay Rs 5,000 through a payment application. Initially, Parmar transferred Rs 2,000 and before he could send the remaining amount, the four accused were arrested by Rajasthan police. Cops identified the four as Farooq Mev, Nahid Mev, Rahis Mev and Samayuddin Mev. "Three other persons have also been cheated by these four accused and we have taken their complaints as well," said inspector M C Vala experiment police station. The three other victims are Parimal Lathigra, Ishit Patni and Subhash Ghodasar. The four fell for an online cheating scam operated by a gang from Alwar in Rajasthan. Rahul Parmar, a software engineer, told police that he got in touch with a woman through an online dating application. "The gang has around 60 members and they used to extort money from people living in Guiarat. has around 60 members and they used to extort money from people living in Gujarat, Rajasthan, Telangana and Tamil Nadu," Vala added. Rajkot police will soon be taking the custody of the four accused from Alwar police.

સંપાદકીય

ન્યાયમાં વિલંબની બીમારી

દિલ્હીના ઉપહાર સિનેમાગૃહ અગિદ્ધકાંડમાં પુરાવા સાથે છેડછાડ મામલે રું વર્ષ ભારતમાં પ્રવાસ ત્યાં પુત્ર અને અને વાર્ગ એક વાર એ જ સાબિત કર્યું કે ત્યાયમાં વિલંબની બીમારીનો કોઇ ઇલાજ નથી. આ પહેલો એવો મામલો નથી, જેમાં ન્યાય આપવામાં જરૂરિયાત કરતાં વધારે મોડું થયું હોય. આ પ્રકારના કેસો સામે આવતા જ રહે છે. એવા કેસો એટલા બધા છે કે તેમને અપવાદ પણ ન કહી શકાય. વાસ્તવમાં જે અપવાદ હોવું જોઇએ. તેણે જ હવે નિયમનું રૂપ લઈ લીધું છે. મોટાભાગના કેસોમાં ૧૫-૨૦ વર્ષનો વિલંબ હવે જાણે સામાન્ય થવા લાગ્યો છે. વિલંબ એવા કેસોમાં પણ થાય છે, જેમને સંગીન માનવામાં આવે છે. આતંકી ઘટનાઓ, સામૂહિક હત્યાઓ, મોટા પાયે હિંસા, લૂંટ, દુષ્કર્મ, કતલ અને રમખાણો જેવા જઘન્ય

અપરાધોમાં પણ એવું જ થાય છે.' કુખ્યાત બેહમઇ કાંડ, જેમાં ફૂલન દેવી અને તેના સાથીઓએ ૨૦થી વધરે લોકોને ગોળીઓથી ભૂંજ નાખ્યા હતા, ૪૦ વર્ષ બાદ પણ ન્યાય માટે રાહ જોઇ રહ્યો છે. આ મામલે મોટાભાગના આરોપી, સાથી અને ત્યાં સુધી રાહ જાઇ રહ્યા છે. આ મામલ માટાભાગના આરાપા, સાલા અન ત્યા સુધા કે પીડિત પણ ન્યાયની રાહ જોતાં જોતાં ગુજરી ચુક્યા છે. આવા કેસોની ગણતરી કરવી પણ મુશ્કેલ છે, જે ન્યાયમાં વિલંભને દર્શાવે છે. જે કેસ જેટલો સંગીન હોય, તેમાં એટલી જ વધુ વાદ લાગે છે. એ જરી જે મામલે જેટલા મોટા વગરદો સંગોવાયેલા હોય છે, તેમાં પણ એટલો જ વધારે વિલંભ થાય છે. તેનું તાજું પ્રમાણ ઉપહાર સિનેમાથર અગિદ્ધકાંડ છે. આ મામલો તેનું પણ ઉદાહરણ છે કે વગદાર લોકો માટે ન્યાય પ્રક્રિયાનું ચીરહરણ કરવું કેટલું આસાન હોય છે. એવો જ એક કેસ દિલ્હીનો જ બીએમડબ્લ્યુ કાંડ કટલું અત્યાન હાય છે. અયા જ એક ક્યા ઇસ્હાના જ બાબનડબ્યું કાડ હતો, જેમાં ત્રણ પોલીસવાળા સહિત છ લોકો માર્યા ગયા હતા. આ મામલે પણ પુરાવા સાથે છેડછાડ કરવામાં આવી હતી. આ છેડછાડમાં બે મોટા વકીલો પણ સંડોવાયેલા હતા, જેમાં એક રાજ્યસભાના સદસ્ય બન્યા.

ન્યાયમાં વિલંબ કયાં કારણોસર થાય છે અને તે વિલંબ કોઈક રીતે અન્યાયનો પરિચાયક બને છે, તેનાથી તે તમામ સારી રીતે વાકેક છે, જેમણે તેનું નિવારણ કરવાનું છે. એવા લોકો સમયે સમયે આ કારણોનો ઉલ્લેખ પણ કરે છે અને ચિંતા પણ વ્યક્ત કરે છે, પરંતુ તેઓ જરૂરી પગલા ભરવાથી ઇનકાર કરે છે. ક્યારેક ન્યાયપાલિકાના લોકો ન્યાયમાં વિલંબ માટે કાર્યપાલિકાના લોકોને કઠેરામાં ઊભા કરે છે તો ક્યારેક તેનાથી વિપરીત સ્થિતિ જોવામળે છે. ક્યારેક કોઈ સંસાધનોની ઉગપનાં રોદગાં રહે છે. તો ક્યારેક કોઈ જરીપુરાજ્ઞા કાયદા, કંગાળ અપરાધિક દંડ સંહિતાનો ઉલ્લેખ કરીને હાથ ઊંચા કરી દે છે. એ જ રીતે ક્યારેક કોઈ તારીખ પર તારીખન સિલસિલાને દોષ આપે છે તો ક્થારેક પોલીસની કાર્યપ્રજ્ઞાલીને. કુલ મળીને બધા સમર્થ લોકો એ સ્વીકાર કરવા તો હંમેશાં તૈયાર દેખાય છે છે, પરંતુ તેનું સમાધાન કરવા માટે કમર કસતા નથી દેખાતા.

જો ક્યારેક વ્યવસ્થાના કોઈ અંગથી કોઈ પહેલ થાય પણ છે તો બીજ અંગ તેમાં રોડાં નાખે છે. જયારે સુપ્રીમ કોર્ટે પોલીસ સુધારા માટે સાત સૂત્રી દિશાનિર્દેશ જારી કર્યા ત્યારે રાજય સરકારો તેને નિષ્પ્રભાવી કરી દેવાના કારસા કરવા લાગી. કેન્દ્ર સરકારે પણ રાજ્ય સરકારોને અનરૂપ વ્યવહાર કર્યો અને એ રીતે સુપ્રીમ કોર્ટના દિશાનિર્દેશો માત્ર કાગળિયા પર રહ્યા. જ્યારે વિધાયિકાએ ઉચ્ચતર ન્યાયપાલિકામાં જજોની નિયુક્તિ પ્રક્રિયાને સુધારવાની પહેલ કરી તો ખુદ સુપ્રીમ કોર્ટ તેને ફગાવી દેવા આગળ આવી. તેણે સંસદ દ્વારા પસાર થયેલ અને વિધાનસભાઓ દ્વારા અનુમોદિત નિયક્તિ કરી શકે! એવં દનિયાના કોઈ લોકતાંત્રિક દેશમાં નથી થતં. પરંત ભારતમાં સરાજાહેર થાય છે

તા તે તતાલા હું. કેન્દ્ર સરકાર એક લાંબા અરસાથી અખિલ ભારતીય ન્યાયિક સેવાની કરપ્ર સરકાર એક લાંબા એરસાવા આવલ બારતાવ ગામક સંવાગ રચના કરવાના પક્ષમાં છે, પરંતુ કેટલીય હાઇકોર્ટી અને રાજ્ય સરકારોને એ વિચાર ગમતો નથી. એવું ત્યારે છે જ્યારે ૧૯૬૦થી જ તેના માટે કોશિશ કરવામાં આવી રહી છે. આ દેર સાથે અંધેરનું પણ એક વરવું ઉદાહરણ છે. આવાં ઉદાહરણોની આપણે ત્યાં કમી નથી. જેમ અખિલ ભારતીય ન્યાયિક સેવાની રચનામાં દિલચસ્પી નથી દેખાડવામાં આવતી. એવી જ રીતે ગ્રામ ત્યાયાલયોની રચનામાં પજ્ઞ. કેટલાય રાજયોએ ગ્રામ ન્યાયાલયોની રચનામાં સહેજ પજ્ઞ દિલચસ્પી નથી દેખાડી. પરિજ્ઞામ એ છે કે લોકોને દરવાજા પર

જ ન્યાય ઉપલબ્ધ કરાવવાનો ઉદ્દેશ્ય પૂરો થવાનું નામ નથી લઈ રહ્યો. ભલે સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ એમ કહે કે જ્યારે ચીજો ખોટી થાય છે તો લોકોને એ તો ભરોસો હોય છે કે ન્યાયપાલિકાથી તેમને રાહત મળશે. એ સાચું નથી. મુસીબતમાં પડેલા લોકો જયારે ન્યાયાલય પાસે જાય છે તો હંમેશાં તેમને તારીખ પર તારીખના સિલસિલા સામે ઝઝૂમવું પડી છ તાં હમશા તેમન તારીખ પર તારીખના સિલસિલા સામે ઝઝુમવુ પડી રહ્યું છે. નીતેલા લગભગ એક વર્ષોય ફિંપ કાયદા વિરોધી મદર્શનકારી દિલ્હીના સીમાંત વિસ્તારોમાં રાજમાર્ગોને ઘેરીને બેઠા છે, પરંતુ સુપ્રીમ કોર્ટ તારીખ પર તારીખ આપવા સિવાય બીજું કહ્યું નથી કરી રહી. તેમના નાક નીચે જ નયાય દેર અને એરેનો શિકાર છે. ન્યાયો વિલ્બંધી કન્ત આર્થિક વિકાસ જ પ્રભાવિત નથી થતો, બલ્કે સામાજિક વિકાસ પર પણ ખરાબ અસર પડે. છે. તે ઉપરાંત લોકોનો લોકતંત્ર અને તેની વ્યવસ્થાઓ પરથી ભરોસો ઉઠે છે. તે ઇપરાત લાકામાં લાકાત અને તમાં ત્યનસ્યા પર વા ખરાસ છે. છે. એટલું જ નાકી, કાયદાના શાસનને ગંભીર આવાત પહોંચે છે અને તેના પરિજ્ઞામોમાં અરાજક તત્ત્વી, અપરાધીઓ અને દેશવિરોધી તાકાતોને બળ મળે છે. એ કોઈથી છૂપું નથી કે સડકો પર ઉતરીને અરાજકતા ફેલાવવા, સ્ત્તા રોકવા, પોલીસ, થાણાં પર હુમલા કરવાના કિસ્સા વધતા જ જાય છે.

સન્માનનું માન

પદ્મ સન્માન મેળવનારા લોકોની યાદીમાં દર વર્ષે એવાં નામોની સંખ્યા વધતી .ખાવી સખદ છે. જે ગમનામ રહીને પોતપોતાની રીતે સમાજની સેવા કરી રહ્યા ુરુપાયા નુપર છે, જુ મુખ્યાન હહારે પાસાધામાં શાંત માત્ર પાસાધાના શાંત માત્ર સ્વા છે. તેમાંથી કેટલાં પાસ તો એવાં છે, જેમણે ક્લારેય વિચાર્યું પણ નહી હોય કે તેમને આ સન્માન મળશે. કેટલાંકને તો આ સન્માન વિશે કશી જાણકારી પણ નહી હોય! જો સરકાર આવા સાચા અને નિસ્ત્રાર્થ સમાજસેવકોને શોધી-શોધીને તેમને પદ્મ સન્માનથી સન્માનિત કરી રહી છે તો તે કક્ત તેમના યોગદાનને જ રેખાંકિત નથી હું જે તે તે કરતી. પુરંતુ દેશના લોકોને નવી દિશા આપવાનું પણ કામ કરી રહી છે. તેની સાથે જ તે પદ્મ સન્માનોનું માન વધારવાનું પણ કામ કરી રહી છે. આ વર્ષએ એવાં નામ એટલા માટે વધ ચર્ચામાં આવ્યાં. કારણ કે આ વખતે બે વર્ષનાં પદ્મ સન્માન એક સાથે આપવામાં આવ્યાં. ગયા વર્ષે કોરોના સંક્રમણને કારણે આ સન્માન આપવાનો સાથે આપવામાં આવ્યા. ગયા વધ કોરોના સંક્રમાણન કારણ આ સન્માન આપવાના ક્રાર્યક્રમ રક કરતી પત્થી હતો. કોઈ પુરસ્કાર-સન્માનાની મહતા ત્યારે જ વધે છે, જ્યારે સર્વથા યોગ્ય લોકો તેને પાત્ર બને છે. છેલ્લા કેટલાક સમયથી પોતપોતાના ક્ષેત્રમાં વિશિષ્ટ યોગદાન આપનારાઓ સાથે-સાથે ગ્રામીણ પુછવૃમિવાળા સાધારણ રીતે જીવન ગુજરનારા લોકોને પણ જે રીતે અસાધારણ કાર્યો માટે પણ પત્ર સન્માન પ્રદાન કરાઈ રહ્યાં છે, તેનાથી એ ધારણા ધ્યસ્ત થઈ રહી છે કે આ સન્માન તેમને જ પળે છે, જેમની સતાનાં વર્ણળો સુધી પહોંચ હોય છે, મોટી સરકાર તેના તમન જ મળ છે, જનના સત્તાના વધુળા સુધા પહાચ હાય છે.માંડા સંતકાર તના માટે ધમ્વાલક ને પાત્ર છે કે તેલે આ પારણને તોડાવા કું કામ ક્યું કે હવાક સમય પહેલાં તો એ કલ્યના કરવી પણ મુશ્કેલ હતું કે રાષ્ટ્રપતિ ભવનમાં સાધારણ વસ્ન પહેલા અને ત્યાં સુધી કે ઉધાડા પગે ચાલનારા લોકો પદ્મ સન્માન લેવા આવશે અને વડાપ્રધાન સંક્રિત કંટાની અન્ય મુખ્ય હસ્તીઓ તમના સન્માનમાં તાળી પાડશે. સડકો પર સંતરો વેચનારા અને તેમ છતાં પોતાના ગામમાં સ્કૂલ ખોલનારા પાડવા. સંકંડા ૧૨ સારા વચ્ચારા અંગલા કર્યા પાયાના કર્યું વ માલ્યાર હરેકાલા હજબ્બા હોય કે પછી જડીબુટીઓ સાથે છોડ-વૃક્ષ લગાવીને પર્યાવરણની સેવા કરનારાં તુલસી ગૌડા અથવા દેશી બીજો દ્વારા જૈવિક ખેતીની અલખ જગાવનાર રાહીબાઈ સોમા કે પછી ટ્રાન્સજેન્ડર લોકનર્તક મંજમ્મા જોગાઠી, આ તમામને સન્માનિત કરવાને કારણે ખરેખર તો પદ્મ સન્માનની જ આભા વધી છે.

મોદીનો કોર્પોરેટ સ્ટાઈલમાં કામ કરવા મંત્રીઓને આદેશ

સરકારનાં તમામ મંત્રાલયોને કોર્પોરેટ સ્ટાઈલમાં કામ કરવા ફરમાન કર્યું છે. અમિત શાહના ગૃહ મંત્રાલયથી તેની શરૂઆત પણ કરી નત્રાલયવા તેવા સરૂજાત પક્ષ કરા દેવાઈ છે. ગૃહ મંત્રાલયે તમામ દળો અને એજન્સીઓને રોજેરોજ કરવાનાં કામ એટલે કે 'વર્ક ટુ ડુ' મોકલવા કહી દીધું છે. બીજા દિવસે આગલા દિવસની યાદીમાંથી કેટલાં કામ થયાં તેનો રીપોર્ટ પણ મોકલવાનો રહેશે.

નાકલવાના રહશ. પીએમઓની સૂચના પ્રમાણે દરેક મંત્રાલયે ફાઈલો-કામનો ઢગ થવા દેવાના બદલે રોજનું કામ રોજ જ કરવાનું રહેશે. મંત્રાલય સાથે સંકળાયેલા તમામ વિભાગ, એજન્સી વગેરેએ રોજેરોજ કથાં કામ કરવાના તેની યાદી મંત્રીને મોકલી આપવાની રહેશે. બીજાં મંત્રાલયો આ વ્યવસ્થા ગોઠવવામાં પડયાં છે ત્યારે ગૃહ મંત્રાલયમાં આ વ્યવસ્થા ્ પણ બની ગઈ છે.

સૂત્રોનો દાવો છે કે, મોદીને કેટલાંક મંત્રાલયોની કામગીરી અંગે વ્યાપક ફરિયાદો મળી હતી. તેના કારણે સરકારની ઈમેજ બગડતી હોવાથી મોદીએ લાલ આંખ કરવી પડી છે

અરકાર ધીરે ધીરે પાટા પર ચારી રહેલી અર્થતંત્રની ગાડીને સ્થિરતા આપવા માટે ચોક્કસ ક્ષેત્રો માટે ખાસ રાહત પેકેજ જાહેર કરે એવી શક્યતા છે. કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારામન આવતા અઠવાડિયે દેશની ટોચની બેંકો અને નાણ સંસ્થાઓના વડાઓને મળવાનાં છે. નિર્મલા બે દિવસની કોન્ફરન્સમાં બેંકો-સંસ્થાઓના વડાઓ સાથે અર્થતંત્રમાં તેજી લાવવા શું કરવું તેની ચર્ચા કરશે. સરકાર અર્થતંત્રમાં તેજી લાવવા

માટે ઔદ્યોગિક ઉત્પાદન વધારવા પર ભાર મૂકી રહી છે. તેના માટે મોટા પ્રમાણમાં રોકડ ફરતી થાય એ જરૂરી છે. નિર્મલા બેંકોના વડાઓને વધારે ને વધારે પ્રમાણમાં રોકડ અર્થતંત્રમાં ઠાલવવા આડેના અઘત ઝમાં કાલવવા આડના અવરોષે દૂર કરવા શું કરવું તેનાં સુચનો પણ માગશે. આ ચર્ચાના આઘારે રાહત પેકેજ જાહેર કરાશે એવો સૂગોનો દાવો છે. સૂગોનું કહેવું છે કે, પૂરોલ-ડીઝલ પરની એક્સાઈઝ ડયુટીમાં કરાયેલા ઘટાડાના કારણે બજારમાં હકારાત્મક

માગે છે તેથી બજેટ પહેલાં ઘણાં

પશ્ચિમ બંગાળમાં મમતા પાંચમ ખંગાળના નેમતા બેનરજી સામેની લડાઈમાં પ્રદેશ ભાજપને દિલ્હી તરફથી પૂરતો 'સહકાર' નહીં મળતો હોવાથી ભાજપના નેતા તૃક્ષમૂલ કોંગ્રેસમાં જઈ રહ્યા હોવાની ફરિયાદ નરેન્દ્ર મોદીને કરાઈ છે. ભાજપનાં સૂત્રોના દાવા પ્રમાણે, ભાજપની રાષ્ટ્રીય કારોબારીમાં બંગાળના નેતાઓએ આ મુદ્દો ઉઠાવ્યો હતો પણ વિસ્તૃત ચર્ચા શક્ય ન હોવાથી પછીથી મોદી સમક્ષ રજુઆત કરાઈ છે. મોદીએ અમિત શાહ પાસે આ મુદ્દે રીપોર્ટ માંગ્યો છે.

ં. બંગાળ ભાજપના નેતાઓની ફરિયાદ છે કે, શારદા ચિટ ફંડ અને કોલસા કૌભાંડમાં અભિષેક બેનરજી સહિતના તણમલ કોંગ્રેસના નેતાઓ સામે મજબૂત પુરાવા હોવા છતાં કોઈ નક્કર કામગીરી કેન્દ્ર સરકારે કરી નથી. અભિષેકની ૧૩૫૨ કરોડ રૂપિયાના કોલસા કૌભાંડમાં પૂછપરછ કરાઈ પણ પછી બધું ઠંડું પડી ગયું. બીજી તરફ મમતા બેનરજી ભાજપના નેતાઓને શોધી શોધીને કેસ કરી રહ્યાં છે ને ગાળિયો કસી રહ્યાં છે તેથી ભાજપમાં ફ્રફડાટ છે. ભાજપના નેતાઓનું કહેવું છે કે, કેન્દ્ર મમતાનો મુકાબલો કરવા આક્રમક વલણ નહીં અપનાવે તો બંગાળમાં ભાજપ પતી જશે.

બિહારમાં યાદવ પરિવારની યાદવાસ્થળી શમી ગઈ હોવાના અને તેજ પ્રતાપ-તેજસ્વી વચ્ચે સમાધાન થઈ ગયું હોવાના સંકેત મળ્યા છે. બુધવારે વિધાનસભામાં વિપક્ષના નેતા તેજસ્વીના જન્મદિવસે તેજ પ્રતાપે માત્ર જન્મદિવસની શુભેચ્છા જ ના આપી પણ પોતાના તેજસ્વીની તસવીર સાથેનાં પોતાના સંગઠનનાં પોસ્ટર્સ પણ ઠેર ઠેર લગાવ્યાં.

તેજ પ્રતાપે તેજસ્વીની સરખામણી 'અર્જુન' સાથે કરીને લખ્યું કે, અપને પરાક્રમ સે તમામ મનુવાદીયોં કો અકેલે પટખની દેને વાલે મેરે અર્જુન કો જન્મદિન કી હાર્દિક બધાઈ. તેજસ્વીના જન્મદિવસે લાલુએ પણ ખુલ્લો પત્ર લખીને તેજસ્વીને બિહારના લખાન તજસ્વાન ખિહારના મુખ્યમંત્રી બનવાની શુભેચ્છા પાઠવી હતી. લાલુ પ્રસાદ સારવાર માટે

વિશ્વસનીયતા પર સળગતા સવાલો

દેશમાં કોઈએ ગઠબંધનની રાજનીતિની કલ્પના નહોતી કરી. આઝાદીના કક્ત ૨૦ વર્ષ બાદ ૧૫ માર્ચ ૧૯૬૭ના રોજ બંગાળમાં પ્રથમ સંયુક્ત ફ્રન્ટની સરકાર બની હતી ૧૯૬૨માં બંગાળમાં વિધાનસભા ચંટણી સમયે ગઠબંધનની ચૂંટણી ્ટલા સગવ ગટળવ ાવધારણાએ જન્મ લીધો હતો કોં ગ્રેસ વિરુદ્ધ યુનાઇટેડ લેફ્ટ ઇલેક્શન કમિટી તથા યુનાઇટેડ લેફ્ટ ફ્રેટ ચૂંટણી લડી હતી. ૧૯૭૭થી લઈને ૨૦૧૧ સુધી સરકારમાં રહેતાં અને ત્યારબાદ પણ હજુ સુધી ડાબેરી મોરચો યથાવત છે. ભલે બધા ડાબેરી પક્ષો યૂન્ય થઈ ગયા હોય, પરંતુ ૩૪ વર્ષોના ડાબેરી શાસનને ખતમ કરવા માટે તૃણમૂલે પણ કોંગ્રેસ સાથે ગઠબંધન કર્યું હતું અને એ ઉદ્દેશ્યમાં સફળ પણ થઈ. જોકે વધુ દિવસ એ ગઠબંધન ટક્યું નહીં. હજુ ગયા અઠવાડિયે કાલીપૂજા પંડાલના ઉદ્દ્વાટન દરમ્યાન મમતા બેનર્જીએ કહ્યું, 'કોંગ્રેસ અવિશ્વસનીય સહયોગી છે, જેણે ભાજપ સાથે હાથ મિલાવી લીધો છે.' એના પર પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અધીર ચૌધરીએ પલટવા કરતાં કહ્યું, 'મમતાએ અસલમાં અમારી પાર્ટીને ખતમ કરવા માટે ભાજપ પાસેથી સોપારી લીધી છે એટલે કે બંને નેતાઓએ એકબીજાની પાર્ટીની વિશ્વસનીયતા પર પ્રશ્ન ચિક્ લગાવી દીધં છે. એવામાં સવાલ એ લગાયા ઠાયુ છે. અવાના સવાલ અ થાય છે કે આખરે 'અવિશ્વસનીય' સહયોગી કોણ છે - તૃણમૂલ કે કોંગ્રેસ? કોંગ્રેસ અને તૃણમૂલ બંને એકબીજા પર ભાજપ સાથે હાથ મિલાવવાનો આરોપ લગાવી રહ્યા

છ. મમતાનું કહેવું છે કે તેમણે એ આશા કેમ રાખવી જોઇએ કે કોંગ્રેસનું તૃણમૂલ સમર્થન કરશે, જ્યારે તેણે પાછલી વિધાનસભા ચૂંટણી પર બધી સીટો પર ચૂંટણી લડી હતી. અલગ-અલગ રાજયોમાં અલગ-અલગ નીતિઓ ન હોઇ શકે. ૨૦૧૧માં બનેલ તૃણમૂલની પહેલી સરકાર દરમ્યાન કોંગ્રેસે વચ્ચે સાથ છોડી

દીધો. અહીં કહેવું જરૂરી છે કે ૨૦૦૯ની લોકસભા ચૂંટણીમાં મમતા કોંગ્રેસ સાથે મળીને ચૂંટણી નનતા કાંગ્રસ સાથે નળાન યૂટ્યા લડ્યાં તાં અને યુપીએ-૨ સરકારનો હિસ્સો હતાં, પરંતુ સપ્ટેમ્બર ૨૦૧૨માં મનુમોહન સરકાર દ્વારા પેટોલિય પદાર્થોની કિંમતોમાં વધારો અને રિટેલ ક્ષેત્રમાં પ્રત્યક્ષ વિદેશી રોકાણ મુદ્દે યુપીએ સાથે છેડો ફાડી લીધો હતો ત્યારબાદ બંગાળમાં પણ કોંગ્રેસ તૃણમૂલ સરકારથી અલગ થઈ

. અસલમાં કોંગ્રેસથી અલગ થઈને ૧ જાન્યુઆરી, ૧૯૯૮ના રોજ મમતાએ તૃણમૂલ કોંગ્રેસની રચના કરી. એ સમયે તેમણે કોંગ્રેસના તત્કાલીન રાજ્ય નેતૃત્વ પ ડાબેરીઓ સાથે સાંઠગાંઠનો આરોપ લગાવતાં પોતાની પાર્ટી બનાવી હતી. ત્યારબાદ મમતા બેનર્જીએ ભાજપ સાથે ગઠબંધન કર્યું અને એનડીએ સરકારનો હિસ્સો બન્યાં. ૧૯૯૯માં પણ મમતા બેનર્જીની પાર્ટી ભાજપ સાથે મળીને જ બંગાળની લોકસભા ચંટણી લડી અને તે કરીથી કેન્દ્ર સરકારમાં સામેલ થયાં. પરંતુ દોઢ વર્ષની અંદર જ તે રેલમંત્રી પદેથી રાજીનામું આપીને ૨૦૦૧માં એનડીએ સરકારમાંથી બહાર આવી ગયાં અને કોંગ્રેસ સાથે મળીને બંગાળ વિધાનસભા ચૂંટણી લડ્યાં અને ૬૦ સીટો જીત્યાં. પછી ર૦૦૩ના અંતમાં તે કોંગ્રેસ સાથે છેડો ફાડી ભાજપ સાથે ગઠબંધન કરી કેન્દ્રીય મંત્રી બન્યાં. ત્યારબાદ ૨૦૦૪ની લોકસભા ચૂંટણીમાં હાર બાદ ફરી તે એનડીએથી અલગ થઈ ગયાં.આ તરફ યુપીએ સરકારે માકપાના નેતૃત્વવાળા ડાબેરી મોરચાએ બહારથી સમર્થન આપ્યું, પરંતુ ૨૦૦૮માં અમેરિકા સાથે પરમાણુ સંધિ પર હસ્તાક્ષર વિરુદ્ધ સમર્થન પાછું ખેંચી લીધું. તેના બીજા જ વર્ષે ૨૦૦૯ની લોકસભા ચૂંટણી પહેલાં તૃણમૂલ અને કોંગ્રેસ વચ્ચે સમજૂતી થઈ ગઈ, જે ૨૦૧૨માં ફરી તૂટી ગઈ.

માતા-પિતાના આશિર્વાદ લેવા દિલ્હી ગયો હતો. આખા યાદવ પરિવારે દિલ્હીમાં તેજસ્વીનો જન્મદિન (રજવ્યો

આરજેડીનાં સૂત્રોનું કહેવું છે કે, લાલુ પ્રસાદે તેજ પ્રતાપ અને તેજસ્વી વચ્ચે સમાધાનની ફોર્મ્યુલા બનાવી તેને બંને ભાઈએ સ્વીકારી છે. આ ફોર્મ્યુલા પ્રમાણે તેજસ્વી બિહારના રાજકારણમાં રહેશે જ્યારે તેજ પ્રતાપને બહેન મિસાના સ્થાને ત્રતાપા બહારા ામસાયા સ્થાય રાષ્ટ્રીય રાજકારણમાં મોકલાશે કે જેથી બંને વચ્ચે સંઘર્ષના થાય. પંજાબમાં ભારે ડ્રામા પછી અંતે

મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચશીએ એડવોકેટ જનરલપદેથી એપીએસ દેઓલને દૂર કર્યા છે. નવજોત સિધ્યુએ ચશીને રીતસર ઘુંટણિયે પાડીને સાબિત કર્યું કે, મુખ્યમંત્રી ભલે ચૂત્રી હોય પણ હાઈકમાન્ડ તેનું કહ્યું કરે છે

ચશ્રીએ રાહુલ ગાંધીને ફરિયાદ ચક્ષાએ રાહુલ ગાયાન ફારયાદ કરતાં રાહુલે સિધ્ધુને અનુ કૂળ આવે એવો નિર્ણય લેવા આદેશ આપતાં ચક્ષીએ સિધ્ધુને લેવા ખાસ હેલિકોપ્ટર મોકલવું પડયું હતું. સિધ્ધુ હેલિકોપ્ટર મોકલવું પડયું હતું. સિધ્ધુ રાજભાવન જતાં ચજ્રીએ પણ રાજભવન જતું પડયું ને દેઓલનું રાજીનામું સ્વીકારાયું હોવાની રાજીયપાલને જાણ કરવી પડી. ચશ્રીનું માન રાખવા સિધ્ધુએ સંયુક્ત પત્રકાર પરિષદ કરી પણ એ પહેલાં પોતાનો કક્કો ખરો કરાવી લીધો.

રાજસ્થનમાં અશોક ગેહલોત અને સચિન પાયલોટ વચ્ચેની મડાગાંઠ ઉકેલવા હવે ખુદ સોનિયા ગાંધી મેદાનમાં આવ્યાં છે. સોનિયાના આદેશથી ગેહલોત અને પાયલોટ બંનેને દિલ્હી બોલાવાયા છે. બુધવારે કે.સી. વેશુગોપાલ અને પ્રભારી અજય માકેને પાયલોટ-ગેહલોતને સામસામે બેસાડીને સમાધાનની ફોર્મ્યુલા તૈયાર કરવા પ્રયત્ન કર્યો પણ ગેહલોતના અસ્કડ વલણના કારણે મડાગાંઠ ના

લાઇ. પ્રિયંકા ગાંધી પણ આ બેઠકમાં હાજર રહેવાનાં હતાં પણ પ્રિયંકા શિમલાથી દિલ્હી પહોંચી ના શકતાં હાજર ના રહી શક્યાં. હવે ગુરૂવારે પ્રિયંકા સાથે ગેહલોત-પાયલોટની ાત્રવકા સાથે બહલાત વાવલાટના બેઠકમાં ઉકેલ આવી જ જશે એવો કોંગ્રેસનાં સૂત્રોને વિશ્વાસ છે. આ બેઠક પછી ગેહલોત સોનિયા ગાંધીને પણ મળે એવી શક્યતા છે. ગેહલો ત નક્કી કરેલી ફોર્મ્યુલાનો તાત્કાલિક અમલ કરે એ માટે સોનિયા સાથે તેમની બેઠક ગોઠવાઈ હોવાનો સૂત્રોનો દાવો છે

સૂત્રાના દાવા છ. સૂત્રોના મતે, ગેહલોત પાયલોટ જૂથને બેથી વધારે મંત્રીપદ આપવા તૈયાર નથી તેના કારણે કોકડું ગૂંચવાયું છે . પાયલોટ જૂથની માગણી મોછામાં ઓછાં ચાર મંત્રીપદની છે રાહુલ અને પ્રિયંકા પાયલોટની માગને વ્યાજબી માને છે.

ઉત્તરપ્રદેશમાં ઉત્તરપ્રદેશમાં ૧૯૫૦ના દાયકામાં જી.બી. પંત (ગોવિંદ વલ્લભ પંત) સત્તા પર હતા ત્યારથી સત્તાનશીન કોઇ પણ મુખ્યમંત્રી પાંચ વર્ષની ટર્મપરી કર્યા પછી કરી સત્તા વર્ષની ટમ પૂરી કર્યા પછા કરો સત્તા પર આવ્યા નથી. આથી રાજકીય વિશ્લેખકોના મતે જો આગામી વર્ષના આરંભે યુ.પી. માં થનારી વિધાનસભા ચૂંટબ્રીમાં જો ભાજપ, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના નેતૃત્વમાં કરી સત્તાસ્થાને આવશે યોગીના હાથે રાજ્યમાં ફક્ત ઇતિહાસ પલટાશે એટલું જ નહિ, પરંતુ મોદી પછીના ભાજપમાં તેઓ સર્વોચ્ચ (વડાપ્રધાન) પદ માટે એક શક્તિશાળી હરીક બની રહેશે રાજકીય વિશ્લેષકો એમ પણ કહે છે કે રાજકીય મહત્ત્વાકાંક્ષા પર પક્ષનું નિયંત્રણ હશે, સાથી-પક્ષો ચક્તિ થઇ ગયા હશે, તેઓ પર અંકુશ રહેશે, વિપક્ષોનો જુસ્સો વધુ નબળો પડશે, એમનું વધુ વિભાજન થશે. જો કે જો ભાજપ ૫૦ ટકા બેઠકો પણ માંડ મેળવી શકશે તો ૨૦૨૪ની

લાભ ગુમાવશે. એનાથી વિપક્ષો મજબૂત થશે અને સાથી-પક્ષોની હિંમત વધશે. પશ્ચિમ અંગાળના રાજ્યપાલ અને ત્યાંની સરકાર વચ્ચેના સંઘર્ષને એક લાંબો ગાળો વીતી ગયા પછી રાજ્યના મુખ્યમંત્રી મમતા બેનરજીએ રાજ્યપાલને આનંદપૂર્ણ શુભ ચેષ્ટા પાઠવી એના ૨૪ કલાક કરતાંઓછા સમયમાં રાજ્યપાલ કરતા આછા સમયમાં રાજ્યયાં જગદીપ ધાનકરે યુ-ટર્ન મારીને, બેંગાલ ગ્લોબલ બિઝનેસ સમિટના

મદ્દે પ.બંગાળ સરકારના વલણની

સંસદીય સામાન્ય ચૂંટણી માટે

કાર્યસ્ ચિનક્કી કરવાની તકનો

આકરી ટીકા કરી. ધાનકરે મંગળવારે સાંજે કરેલી ટ્વિટમાં સમિટને લગતા મહત્ત્વપૂર્ણ મુદ્દે રાજ્ય સરકારનો જવાબ માગવામાં આવ્યો છે.

इवि ६/इलालना झोटाथी विवाह બનારસ હિંદુ યુનિવર્સિટીનો ઉર્દુ વિભાગ 'સારે જહાંસે અચ્છા' ગીતના રચયિતા કવિ ઇકબાલના જન્મ દિવસ ૯ નવેમ્બરે ઉર્દુ દિવસ ઉજવે છે. ગઇ ૯ નવેમ્બરે આ પ્રસંગે અહીં યોજાયેલા વેબિનારમાં કવિ અહાં પાજપલાં પોજપારમાં કોય ઇકબાલનો ફોટો ગોઠવાયો હતો. ૧૯૦૪માં ૨ચાયેલા ઉપરોક્ત ગીતથી જાણીતા બનેલા કવિ મહંમદ ઈકબાલના ઉપરોક્ત કોટા સામે કોલેજના અનેક વિદ્યાર્થીઓએ વાંધો ઉઠાવ્યો અને પ્રશ્ન કર્યો કે યુનિવર્સિટીના સ્થાપક પંડિત યુરાવાહારા વ્યવસ્થ મદનમોહન માલવિયનો ફોટો વેબિનારમાં કેમ મૂકવામાં આવ્યો

શિરોમણિ અકાલી દળના નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી હરસિમરત કૌર બાદલે પાકિસ્તાન સાથેના કરતારપુર સાહિબ કોરિડોરને ઝડપભેર ફરી ખોલવાની માગણી સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આ મદે અંગતપણે દરમિયાન થવાની નુદ અગાપલા દરાનવાન ઘવાના વિનંતી કરી છે. કૌરે કહ્યું કે કરતારપુર સાહેબની પવિત્ર ભૂમિને ભારતમાં સમાવાય અને એના બદલામાં પાકિસ્તાનને અન્યત્ર જમીનનો યોગ્ય ભાગ આપવામાં આવે. આ મુદ્દે દરખાસ્તનો પ્રારંભ કરવા મોદીને અરજ કરાઇ છે. અગાઉ હસૈનીવાલા ગામનો બદલો પણ આ રીતે કરાયો હતો. આ વિનિમય સંબંધી સૌ પહેલી દરખાસ્ત રજ કરી હોવાની યાદ હરસિમરતે એમના બે પાનાના પત્રમાં આપી છે

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને એમના સાથી-પ્રધાનોએ ગયા ગુરૂવારે શહેરના ત્યાગરાજ સ્ટેડિયમમાં ભવ્ય પુજા સાથે દીપોત્સવની ઉજવણી કરી, એ અગાઉ દિલ્હી સરકારની વડીલો માટેની નિઃશુલ્ક તીર્થ-યાગા યોજનામાં અયોધ્યાનો સમાવેશ કરાયો. રામ પ્રત્યેની સમર્પિત ભાવનાવાળી આપની આ કામગીરી ભાવનાવાળી આપની આ કામગારા ભાજપની રાજકીય મહત્ત્વાકાંક્ષાનું જાણે પ્રતીક બની રહી છે. અયોધ્યાની નિ:શુલ્ક પ્રવાસ યોજનાની ઘોપણા, પોતાને રામભક્ત તરીકે ઉપસાવવાનો પ્રયત્ન કરતા હોવાનું જણાતા કેજરીવાલ ગયા મહિને રામનગરીની મુલાકાતે ના નાહન સાનાના તુવાડા ઇ આવ્યા એ પછી તુર્ત કરાઇ. દિલ્હી સરકારે 'દિલ્લી બાઝાર

નામનું ઓનલાઇન પોર્ટલ શરૂ કરવાનું નક્કી કર્યું છે. દિલ્હીવાસીઓ એમુના લાજપતનગર, ખાન માર્કેટ, સરોજિનીનગર, જનપથ વગેરે સ્થળોએ આવેલા જારોમાંથી ઉપરોક્ત ઓનલાઇન પોર્ટલનો ઉપયોગ કરી ખરીદી કરી શકશે. જે કે દિલ્હીવાસીઓ આ વિષે અલગ-અલગ મત ધરાવે છે. કેટલાક કહે છે કે નોકરી અને જિંદગી વચ્ચે સમતુલા જાળવવા માગનારા વ્યાવસાયિકો માટે આ ઉત્તમ વ્યવસ્થા છે, જ્યારે અન્ય જૂથ કહે છે કે ખરીદીમાં બાર્ગેનિંગનું ઘણું મહત્ત્વ છે કારણ કે એનાથી તમને યોગ્ય કિંમત ચૂકવવાનો સંતોષ મળે છે.

शक्ष देवाँच ईन्डस्टील विभिटेड

રોજ રેચાન ઉપસ્ટાર દિવાના ક મોન: Lift2001993PLC0001993PLC0001980 સાર્ક્સ એકિંગ કર્યો ન ૧૦૧૧(૩, ૧૫૧ નાર્ફળ, ૧૧૦મો નિયાના દારા એન નામ રહ્યો (લી.) અર ૧૩૦ મોન ૧૧૦ નાર્ફળ, ૧૧૦મો નિયાના ૧૧૦ નાર્ક્સ ૪૦૦ કર્યા ઉંચેલઃ Investors' વિદ્યાસભાદના આપ્રતામાં આપ્રતામાં ૧૫૦ કર્યા અને અધ્યાસભાદના સ્થામ કરતા કરતા સ્થામ કરતા કરતા સ્થામ કર

વિગતો કામકાજમાંથા કુલ આવક (વા···લ) ચોખ્ખો નફો / (નુકશાન) (ટેક્સ પહેલાની, અસામાન્ય અને / અથવા વિશિષ્ટ પ્રકારની આઇટમો) યોખ્ખો નફો / (નુકશાન) (ટેક્સ પહેલાની, અસામાન્ય અને / અથવ વિશિષ્ટ પ્રકારની આઇટમો) યોખ્યો નફો / (નુકશાન) (ટેક્સ પહેલાની, અસામાન્ય અને / અથવ (3,477.82 ચાબ્બા નામ / (નુકશાન) (ટેક્સ પહેલાની, અસામ વિશિષ્ટ પ્રકારની આઇટમો) નામ / (નુકશાન) ટેક્સ પછી અને બીજી સાંધોગિક આવક અથવા અસાધારણ આવ (ટેક્સ પછી) ઇક્વિટી શેરમૂડી અન્ય ઇક્વિટી (3.477.82) (870.71) (891.53 (870.71) 3,464.54 (891.53) 3,464.54 (1.00) (1.00)

ધ : એ. આઈ ઉપરોક્ત દર્શાવેલ નાલાંકીય પરિસાય રિઝૂપોલુકાન પ્રોકેશનલ દ્વારા જે મુજબૂત માહિતી કંપનીને આપવામાં આવી છે, તેના આપદે તૈયાર કરવા આવેલ છે. તારીખ ૧૫મી નવેખર ૧૦૧૧ના રોજ બળેલ બૈક્કમાં આ પરિસાય ઓદિક એટી મી. બોક હાયરેક્ટર અને તેની સાથે રિઝૂલેશન પ્રોકેશનલ દ્વાર તમાપરાચામાં આવા છે. એ ભેલાવ્યાલ કરવામાં આદી હતી.

તમારલવામાં આવ્યા છે અને ખલામલો કરવામાં આવા હતા. બી. કંપની એક્ટ ૨૦૧૩ સી કલમ ૧૩ સાથે નિયમ ૩ વાંચતા (ઇન્ટિયન એકાઉન્ટીંગ સ્ટાન્ડર્ડ) નિયમ ૨૦૧૫ અને કંપની (ઇન્ટિયન એકાઉન્ટીંગ સ્ટાન્ડર્ડ) સુધારં નિયમ ૨૦૧૬ માં વલવેલા ઇન્ટિયન એક્ટાઉન્ટીંગ સ્ટાન્ડર્ડ પ્રમાણે પરિસામ તૈયાર કરવામાં આવ્યા છે. સી. સેબીની કલમ 33 (લિસ્ટીંગ એન્ડ અધર ડિસક્લોઝર રિકવાયરમેન્ટ્રસ) રેગ્યુલેશન્સ, ૨૦૧૫ મુજબ કંપની ના ઓડિટરદ્વારા પૂર્ણ કરવામાં આવેલ છે અને

તેમને સુચવેલા સુધારા- વધારા કરવામાં આવ્યા છે. વાર્ષિક નાલાંકીય પરિજ્ઞામોની સંપૂર્ણ માહિતી સ્ટોક એક્સચેંજની વેબસાઇટ www.bseindia.com અને કંપની વેબસાઇટ www.rajrayon.com રિયર પણ રિપલબ્ધ છે

YASH CHEMEX LIMITED FORMERLY KNOWN AS YASH CHEMEX PRIVATE LIMITED

411, 4 TH FLOOR, SIGMA ICON-1, OPP. MEDILINK HOSPITAL SATELITE, AHMEDABAD-380015.

"TELE:- 079-40028639/26730257/26730258, Email:- yashchem@hotmail.com, "Website:- www.yashchemex.com CIN:L74110GJ2006PLC048385

lited Financial Results for the Quarter and Half Year Ended Septe

		Particulars	Quarter Ended 30/09/2021	Quarter Ended 30/06/2021	Quarter Ended 30/09/2020	Year Ended 31/03/2021	Quarter Ended 30/09/2021	Quarter Ended 30/06/2021	Quarter Ended 30/09/2020	Year Ended 31/03/2021
ı	1.00	Total Income from Operations	1.448.28	1.558.02	1.027.97	4.588.06	2.049.53	1.960.77	1.318.54	5.782.59
l	2.00	Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary items)	39.32	21.64	(6.46)	178.86	86.07	85.53	21.38	360.73
		Net Profit / (Loss) for the period before tax (after Exceptional and/or Extraordinary items#)	39.32	21.64	(6.46)	178.86	86.07	85.53	21.38	360.73
		Net Profit / (Loss) for the period after tax (after Exceptional and/or Extraordinary items)	29.44	16.15	(3.82)	126.00	63.70	66.55	17.56	251.44
	5.00	Total Comprehensive Income for the period [Comprising Profit / (Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax)]		61.71	44.75	128.13	73.82	112.11	66.13	253.57
l	6.00	Equity Share Capital of Face Value Rs.10/- Each	1,024.34	1,024.34	1,024.34	1,024.34	1,024.34	1,024.34	1,024.34	1,024.34
l		Earnings Per Share (of Rs. 10/- Each) (for continuing & discountued operatoions):								
ı		A: Basic	0.29	0.16	(0.04)	1.23	0.62	0.65	0.17	2.45
ı		B: Diluted	0.29	0.16	(0.04)	1.23	0.62	0.65	0.17	2.45

www.yashchemex.com.

The dover unaudited financial results for the Quarter and Half Vare raided on September 30,0201 know been reviewed by the Audit Committee

The dover unaudited financial results for the Quarter and Half Vare raided on September 30,0201 know been reviewed by the Audit Committee

The Audit Committee of the Com

By Order of Board of Directors

Place: Ahmedabad Date: 12/11/2021

Pritesh Shah Managing Director DIN: 00239665